



ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ

જુની કલેક્ટર ઓફીસ, કણબીવગા ભરૂચ

ફોન નં-(૦૨૬૪૨)૨૨૨૦૭૫/૨૨૨૦૭૪/૨૨૨૦૭૩

ફેક્સ નં-૨૨૨૦૭૬ Email: ceo.bauda@gmail.com

બૌડા/બાંધકામપરવાનગી/BH-1183/વશી/૩૪૫૩૭

તા.૦૯/૦૯/૨૦૧૬

બાંધકામ પરવાનગી નં- ૬૧૫૦

પ્રતિ,

શ્રી જીતેન્દ્ર પ્રવિણચંદ્ર મહેતા
રે.બી-૪૪, સંતકૃપા સોસાયટી,
આઈનોક્ષ મલ્ટીપ્લેક્સ સામે,
મકતમપુર, ભરૂચ.

વિષય:- મોજે.રહાડપોર, તા.જી.ભરૂચના ભરૂચ-પાલેજ-ટંકારીયા રોડ વિસ્તારના
બ્લોક નં.૩૮, ક્ષેત્રફળ:-૬૫૭૬.૦૦ ચો.મી. વાળી જમીનમાં રહેણાંક
તથા વાણિજ્યના હેતુ માટે બાંધકામ પરવાનગી આપવા બાબત.

સંદર્ભ :- (૧) આપની તા.૨૫/૧૦/૨૦૧૭ ની અરજી.

(૨) કલેક્ટરશ્રી, કલેક્ટર કચેરી, ભરૂચના હુકમ ક્રમાંક:ભુમી/બી.ખે./
વશી/૨૨૦૦ તા.૨૫/૦૪/૨૦૧૭

ઉપરોક્ત વિષય અને સંદર્ભ બાબતે શરતી બાંધકામ પરવાનગી તથા મંજૂર કરવામાં આવેલા
નકશા આ સાથે સામેલ છે.

બિડાણ :-

- (૧) બાંધકામ પરવાનગી પત્ર.
- (૨) મંજૂર કરેલા નકશા.

GRM CONSTRUCTION

PARTNER




મુખ્ય કારોબારી અધિકારી
ભરૂચ-અંકલેશ્વર શહેરી
વિકાસ સત્તા મંડળ
ભરૂચ

- નકલ રવાના:- (૧) જીલ્લા કલેક્ટરશ્રી, કલેક્ટર કચેરી, ભરૂચ.
(૨) ગ્રામ પંચાયત રહાડપોર, રહાડપોર, ભરૂચ.
(૩) બાંધકામ પરવાનગી-સિલેક્ટ ફાઈલ



GRM CONSTRUCTION

PARTNER



ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ

જૂની કલેક્ટર ઓફીસ, કણબીવગા ભરૂચ

ફોન નં-(૦૨૬૪૨)૨૨૨૦૭૫/૨૨૨૦૭૪/૨૨૨૦૭૩

ફેક્સ નં-૨૨૨૦૭૬ Email: ceo.bauda@gmail.com

બાંધકામ પરવાનગી

શ્રી જીતેન્દ્ર પ્રવિણચંદ્ર મહેતા મોજે.રહાડપોર, તા.જી.ભરૂચના ભરૂચ-પાલેજ-ટંકારીયા રોડ વિસ્તારના બ્લોક નં.૩૮, ક્ષેત્રફળ:-૬૫૭૬.૦૦ ચો.મી. વાળી જમીનમાં આવેલ જમીનમાં રજુ કરેલા સુચિત બાંધકામના પ્લાન નીચેના પત્રકમાં દર્શાવ્યા મુજબ

Built up Area										
Block		Hollow Plinth	Higher Ground Floor	First Floor	Second Floor	Third Floor	Fourth Floor	Terrace Floor	Total	Total
Block A,B,C,D	Shop	756.84	751.85	-	-	-	-	-	1508.69	4347.90
	Flats			734.84	734.84	734.84	553.05	81.64	2839.21	
Block E,F,G,H	Flats	734.84	734.84	734.84	734.84	734.84	734.84	81.64	4490.68	4490.68
Block I,J,K,L	Flats	734.84	734.84	734.84	734.84	734.84	734.84	81.64	4490.68	4490.68
Block M,N,O,P	Shop	756.84	751.85	-	-	-	-	-	1508.69	4347.90
	Flats			734.84	734.84	734.84	553.05	81.64	2839.21	
Total		2983.36	2973.38	2939.36	2939.36	2939.36	2575.78	326.56	17677.16	17677.16

F.S.I. Area										
Block		Hollow Plinth	Higher Ground Floor	First Floor	Second Floor	Third Floor	Fourth Floor	Terrace Floor	Total	Total
Block A,B,C,D	Shop	132.05	100.63	-	-	-	-	-	232.68	3285.64
	Flats	-	576.19	659.96	659.96	659.96	496.89	-	3052.96	
Block E,F,G,H	Flats	-	659.96	659.96	659.96	659.96	659.96	-	3299.80	3299.80
Block I,J,K,L	Flats	-	659.96	659.96	659.96	659.96	659.96	-	3299.80	3299.80
Block M,N,O,P	Shop	132.05	100.63	-	-	-	-	-	232.68	3285.64
	Flats	-	576.19	659.96	659.96	659.96	496.89	-	3052.96	
Total		264.10	2673.56	2639.84	2639.84	2639.84	2313.70	-	13170.88	13170.88

કુલ જમીનનું ક્ષેત્રફળ (ચો.મી.)	કોમન પ્લોટ (ચો.મી.)	રોડ એરીયા (ચો.મી.)	ઓપન માર્જીન એરીયા (ચો.મી.)	પાર્કિંગ (ચો.મી.)
૬૫૭૬.૦૦	૬૫૯.૮૮	૧૦૧૮.૫૯	૧૯૧૪.૧૭	૩૮૧૨.૯૦

GRM CONSTRUCTION
PARTNER





કુલ બિલ્ટઅપ એરીયા : ૧૭૬૭૭.૧૬ ચો.મી. રહેણાંક તથા વાણિજ્યના હેતુ માટે નીચે જણાવેલી ખાસ શરતોને આધીન રહીને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ (સને ૧૯૭૬ ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં.૨૭) ની કલમ - ૨૯/૧ (૧) ૨૯/૧ (૨) ૨૯(૧) (૩) અથવા ૪૯ (૧) (બી) હેઠળ બાંધકામ પરવાનગી આપવામાં આવે છે.

શરતો :-

(૧) આ વિકાસ પરવાનગી આપ્યા તારીખથી ૧૨ માસ સુધી અમલમાં રહેશે તથા આ હુકમની તારીખથી નિયમોનુસાર મળવાપાત્ર સમયમર્યાદામાં આપેલ મંજૂરી મુજબનું વિકાસ કાર્ય સમયાંતરે રીન્યુઅલ મેળવી પુર્ણ કરવાનું રહેશે તથા તે અંગેનું સત્તામંડળનું ઓકયુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે. તેમ ન કરવામાં આવે તો આપેલ વિકાસ પરવાનગી આપો આપ રદ થયેલી ગણાશે તથા તે અન્વયે ભરેલ સિક્યોરીટી ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે.

(૨) આ પરવાનગી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની જોગવાઈઓ હેઠળ એક વર્ષની મુદત માટે માન્ય છે.

(૩) મંજૂર કરેલા પ્લાન સિવાય વધારાનું બાંધકામ અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય કરી શકાશે નહીં. તેમ છતાં બીન-પરવાનગીનું બાંધકામ કરવામાં આવશે તો તે તોડી પાડવામાં આવશે અને સઘળો ખર્ચ પરવાનગી માંગનાર પાસેથી વસુલ કરવામાં આવશે.

(૪) રસ્તા ઉપર પાલખ તેમજ માટી, રોડા, ઈંટ કપચી વિગેરે તેમજ ઇમારતી સામાન આ વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય મુકવા નહીં યા નાંખવા નહીં અને અરજદારે પરવાનગી મેળવી હોય તે ઉપરના સામાનથી અવર-જવર કરનાર વ્યક્તિઓને તથા વાહન-વ્યવહાર વિગેરેને કોઈ પણ જાતની હરકત થવી જોઈએ નહીં.

(૫) પરવાનગી મુજબનું બાંધકામ પુરૂ થયા પછી સદર મકાનનો ઉપયોગ કરવા માટે બાંધકામ પુરૂ કરવા કંમ્પ્લીશન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.

(૬) આ પરવાનગી મળ્યેથી સરકારશ્રીનો બીન ખેતીનો ધારો તથા અન્ય રકમો લેન્ડ રેવન્યુ કોડ મુજબ તે પરવાનગી માંગનારને શીરે છે અને તે ભરવાની કાર્યવાહી કરવાની જવાબદારી પરવાનગી માંગનારની રહેશે.

GRM CONSTRUCTION

 PARTNER





(૭) શહેરી વિકાસ સત્તામંડળ તરફથી આપશ્રીને જે જમીન ઉપર બાંધકામ બનાવવાની પરવાનગી આપવામાં આવેલ છે તે જમીનની કાયદેસરની માપણી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રી ભરૂચ ધ્વારા ડી.આઈ.એલ.આરશ્રી ભરૂચ પાસે કરાવી મારવામાં આવેલ ખુંટ શહેરી વિકાસ સત્તામંડળના સક્ષમ અધિકારીશ્રીને રૂબરૂ બતાવ્યા બાદ બાંધકામ શરૂ કરાવવું તેમ કર્યા સિવાય શરૂ કરાવવા આપના ખર્ચે અને જોખમે બાંધકામ દુર કરવામાં આવશે.

(૮) વિકાસ નકશાની રોડ લાઇન-માર્જિન તરીકે તથા રસ્તા તરીકે ખુલ્લી રાખવાની જગ્યા શહેરી વિકાસ સત્તા મંડળના સક્ષમ અધિકારીશ્રી પાસે સમજી સ્થળે લાઈન આઉટ કરાવ્યા બાદ જ બાંધકામ શરૂ કરાવવું.

(૯) મકાનની પ્લીથ સુધીનું બાંધકામ પુરૂ થયું છે તે અંગેની લેખિત જાણ આ કામના આર્કિટેક્ટના સર્ટીફિકેટ સહિત કરવી અને પ્લીથ ચેકીંગ સર્ટીફિકેટ મળ્યા બાદ જ આગળ કામ શરૂ કરાવવું.

(૧૦) સુચિત બાંધકામમાં પ્લીથનું માપ નકશા મુજબ સ્થળે જાળવવાનું રહેશે.

(૧૧) વખતોવખત શહેરી વિકાસ સત્તામંડળ તરફથી તથા સરકારશ્રી તરફથી વિકાસ માટેના જે નિયમો કે સુચનાઓ તથા જાહેરાત કરાય તે બંધનકર્તા રહેશે.

(૧૨) ઉપર જણાવેલ શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો ૧૯૭૬ની કલમ ૨૯/૫, ૩૫, ૩૭, ૪૯/૧ અને ૯૮ વગેરેની જોગવાઈ મુજબ દંડ તથા શિક્ષાને પાત્ર રહેશે.

(૧૩) રજુ થયેલ નકશામાં દર્શાવ્યા મુજબનો વિકાસ કરતાં પહેલા સ્થળે ખાનગી હક્કોને નુકશાન ન થાય તેમ યોગ્ય તે અધિકૃત પ્રવેશ રજુ કરેલ પુરાવા મુજબ મેળવી લેવાનો રહેશે.

(૧૪) વાણિજ્ય બાંધકામને લગતા સરકારશ્રીના જુદા જુદા ખાતાઓના નિતી નિયમો પણ અરજદારશ્રીને બંધનકર્તા રહેશે તથા તે અન્વયે સંબંધકનું ન વાંધા પ્રમાણપત્ર મેળવી અત્રે રજુ કરવાનું રહેશે.

(૧૫) સરકારશ્રીનો શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના હુકમ ક્રમાંક:૫૨૨૧/૧૦૨૦૦૦/૧૪૩૭/અ તા.૨૯/૦૪/૨૦૦૦ અન્વયે સદર જમીનમાં વરસાદી પાણીના વહન માટે પરકોલેટીંગ બોરવેલની વ્યવસ્થા રાખવાની રહેશે.

GRM CONSTRUCTION
PARTNER





(૧૬) સવાલવાળી જમીનમાંથી કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રીક લાઇન પસાર થતી હોય તો તે અંગે સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખાત્રી/ચકાસણી કરાવી તેનાથી છોડાવા પડતા માર્જીનલ અંતરો બાબતે સંબંધિત ખાતાનો અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.

(૧૭) નકશામાં દર્શાવેલ મુજબના માપો, માર્જીનો તથા ખુલ્લી જગ્યાઓ સ્થળ ઉપર છોડવાની સંપૂર્ણ જવાબદારી માલિકની, એન્જિનિયરશ્રીની અને આર્કિટેક્ટશ્રીની રહેશે.

(૧૮) સરકારશ્રીના તા.૨૯/૦૫/૨૦૦૧ના હુકમ ક્રમાંક/પરચ/૧૦૦૨૦૦૧/૪૫૫/૮ મુજબ વિકાસ નિયમોમાં સ્ટ્રક્ચરલ ડીઝાઇનના નિયમોમાં ભુકંપ માટેની નેશનલ બિલ્ડિંગ કોડ તથા ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની જોગવાઈઓ મુજબના પ્રમાણપત્રો, સોઇલ ટેસ્ટિંગ, સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટીના પ્રમાણપત્રોની સક્ષમ અધિકારીશ્રી પાસે ચકાસણી કરાવી લેવાની રહેશે. તથા સેક્શન-૨ મુજબ આર્કિટેક્ટ/એન્જિનીયર/સ્ટ્રક્ચરલ ડીઝાઇનર/કલાર્ક ઓફ વર્ક્સ/ડેવલોપર્સ તરફથી ઘટતી કાર્યવાહી કરાવવાની રહેશે. તેમજ બાંધકામના દરેક તબક્કે પ્રોગ્રેસ સર્ટિફિકેટ સક્ષમ અધિકારીશ્રી ધ્વારા મેળવી લેવાનું રહેશે. તેમજ બાંધકામ પૂર્ણ થયેથી મકાન વપરાશ પ્રમાણપત્ર પણ સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી લેવાનું રહેશે.

(૧૯) સવાલવાળી જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવી તે મુજબની સ્ટ્રક્ચરલ ડીઝાઇન કરાવવાની રહેશે તથા તે પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જિનીયરશ્રીની દેખરેખ હેઠળ બાંધકામ કરવાનું રહેશે.

(૨૦) કોમર્શીયલ/રહેણાંકના ત્રણથી ઉપરના માળ અંગે સ્ટ્રક્ચરલ ડીઝાઇન અંગેનો એક સેટ અત્રેની કચેરીએ રજુ કરવાનો રહેશે.

(૨૧) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમ ક્રમાંક વનમ-૧૦૦૮-૩૨૬૦-લ તા.૧૦/૦૩/૨૦૧૦ ની જોગવાઈ મુજબ કુલ:૯૯ વૃક્ષોનું વાવેતર/જાળવણી કરવાની રહેશે.

(૨૨) કોમન પ્લોટ વાળી જમીનની માલિકી સોસાયટીના તમામ સભ્યોની સંયુક્ત રહેશે. કોમન પ્લોટ વેચી શકાશે નહીં. કોમન પ્લોટમાં ગુજરાત વિદ્યુત બોર્ડના ટ્રાન્સફોર્મર માટે અલાયદી જગ્યા રાખવાની રહેશે.

(૨૩) સ્થળે બાંધકામ શરૂ કરતાં પહેલાં ૭ (સાત) દિવસ અગાઉ સોઇલ ટેસ્ટ રીપોર્ટ તથા સ્ટ્રક્ચરલ ડીટેઇલ ડ્રોઇંગ રજુ કરવાના રહેશે.



GRM CONSTRUCTION

PARTNER



(૨૪) સદર હું જમીનમાં બિનખેતીનો ઉપયોગ કરતા પહેલા અન્ય કાયદા હેઠળ પરવાનગી લેવાની થતી હોય તો જે તે સંસ્થા પાસેથી તે મેળવી લેવાની રહેશે.

(૨૫) વિકાસ કામની પરવાનગી સર્વે નંબર/અથવા અંતિમખંડ નંબર અગર પ્લોટમાં અરજદાર જે જમીનમાં માલિક છે તે જમીન પુરતી પરવાનગી આપવામાં આવેલ છે.

(૨૬) આ પરવાનગીના કારણે

- સદર મિલ્કતમાં પ્રસ્થાપિત થયેલ ઈઝમેન્ટ ઓફ રાઈટ્સ, માલિકી અંગેની પરવાનગી મળતી નથી.
- સુચિત બાંધકામ, બાંધકામના માળખાની તથા બાંધકામના માલ સામાનની ગુણવત્તા બાબતેની પરવાનગી મળતી નથી.
- મિલ્કતની સ્થળસ્થિતિ અને તેના દફતરે નોંધાયેલ ક્ષેત્રફળ તથા સ્થળસ્થિતિના સ્ટ્રક્ચરલ રીપોર્ટ અથવા સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ બાબતેની પરવાનગી મળતી નથી.

(૨૭) મંજૂર થયેલ પ્લાન મુજબનો વિકાસ શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ નિયમોનુસારના ડીટેઈલ વર્કીંગ ડ્રોઈંગ તથા સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ અત્રે રજુ રાખી તથા તેના આનુષંગિક રીપોર્ટસ સમય અંતરે રજુ કરી તથા તબક્કાવાર પ્રગતિની અત્રે નિયત નમુનામાં જાણ કરી તપાસ કરાવવાની શરતોએ વિકાસ પરવાનગી આપવામાં આવતી હોઈ તેનો ભંગ થયે આપેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.

(૨૮) વિકાસ નકશાને નગર રચના યોજનાની જુદા જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરૂધ્ધનો ઉપયોગ કરી શકાશે નહીં.

(૨૯) વિકાસ માટેની અંદર બતાવેલી શરતોમાંની કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો શહેરી વિકાસ સત્તામંડળ તે શરતોનો અમલ કરાવી શકશે અને તેવા કૃત્યને લીધે જે કાંઈ નુકશાન - ખોટ કે હરકત માલિકને થાય તે બદલ કોઈ પણ બદલો મળી શકશે નહીં.

(૩૦) મંજૂર નંબરમાં બતાવેલી જમીનમાંથી “બૌડા” એ કંઈક જમીન લીધી હશે અગર કોઈ ભાગ તે છોડાવવા હુકમ કરેલો હશે અગર સનદ સિવાયના કોઈ ભાગ “બૌડા” એ કબજો કર્યો હશે તો તે સિવાયના ભાગ માટે વિકાસ પરવાનગી અધિકૃત સનદના માપને આધીન રહીને આપેલ ગણાશે.

GRM CONSTRUCTION

PARTNER





(૩૧) વિકાસ પરવાનગી હાલના ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિનિયમો મુજબ આપવામાં આવી છે અને ખાનગી હક્કોના નુકશાન અંગે સત્તામંડળ કંઈ પણ જવાબદારી લેતી નથી.

(૩૨) આ વિકાસ પરવાનગી પત્ર સત્તામંડળના અધિકૃત અધિકારી/કર્મચારી જોવા માંગે તો તેમને બતાવવા માલિક બંધાયેલ છે. તે નહીં બતાવશે તો બાંધકામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે.

(૩૩) રસ્તા ઉપર ઇમારતી સામાન અગર પુરણી પ્રથમથી રજા મેળવ્યા સિવાય નાંખવી નહીં. રજાથી નાંખેલ પુરણી વિગેરે વ્યવસ્થિત જોઇતું કોર્ડન કરી ટ્રાફિકને અડચણ ન થાય તેમ નાંખવી.

(૩૪) બાંધકામ નીચેની લેન્ડ એકવીઝેશન એક્ટની/(૧૯૮૪) મુજબ એકવાયર કરવાને સદર એક્ટની કલમ-૪ અન્વયે નોટીફિકેશન નિકળ્યા હશે તો એકવીઝેશન એક્ટ ૨૪ (૭) મુજબ મે.કલેક્ટર સાહેબની રજા બાંધકામ શરૂ કરતાં પહેલા લેવાની રહેશે.

(૩૫) વખતોવખત શહેરી વિકાસ સત્તામંડળ તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જાહેરાત કરાય તે બંધનકર્તા રહેશે.

(૩૬) ઉપર જણાવેલી શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ ૩૫,૩૬,૩૭ ની જોગવાઈ મુજબ દંડ તથા જરૂરી પગલાને પાત્ર થશે.

(૩૭) જો પ્રશ્નવાળી જમીન ઉપર બોજો હશે તો ધિરાણ કરનાર સંસ્થાની શરતો પણ બંધનકર્તા રહેશે.

(૩૮) ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ સિવાયના અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ લેવાની થતી પરવાનગી મેળવી લેવાની રહેશે.

(૩૯) ફેક્ટરી બાંધકામને લગતા સરકારશ્રીના જુદા જુદા ખાતાઓના નિતીનિયમો પણ અરજદારને બંધનકર્તા રહેશે.

(૪૦) માર્જીનવાળા ભાગમાં પ્લોટની ફરતે એક બીજાથી ૩.૦૦ મીટરના અંતરે શરત મુજબ વૃક્ષો ઉગાડવાના રહેશે.

GRM CONSTRUCTION
PARTNER





(૪૧) ઉપર જણાવેલ કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો આપેલી પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.

(૪૨) શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૫/૨૦૧૦ ના પત્ર ક્રમાંક:પરચ-૧૦૨૦૧૦-૨૭૭૬ થી જણાવ્યા મુજબ બોરવેલ/ટયુબવેલમાં નાના બાળકો પડી જવાની દુર્ઘટનાઓ નિવારવા માટે સર્વોચ્ચ અદાલતે નક્કી કરેલ ગાઇડ લાઇન મુજબ તકેદારીના પગલાં લેવાના રહેશે.

(૪૩) સદર પરવાનગી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ-૧૭(સી)(૧)હેઠળ તા.૨૮/૦૩/૨૦૧૭ જાહેરનામાં ક્રમાંક:GH/V/54 of 2017 DVP-202013-4903-L તથા તા.૨૬/૦૫/૨૦૧૭ ના સુધારા હેઠળના જાહેરનામાં ક્રમાંક:GH/V/102 of 2017 DVP-202013-4903-L થી મંજૂર કરેલ વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ તથા તે સમયે મંજૂર થયેલ GDCR ને આધિન આપવામાં આવે છે.

(૪૪) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમ-૧૯૭૯ હેઠળ આપવામાં આવેલ વિકાસ પરવાનગીથી કોઈપણ વ્યક્તિ ધ્વારા બાંધકામ / વિકાસ કાર્યથી સદર બાંધકામ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઈજા અથવા નુકશાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી બાંધકામ કરનાર/માલિક ની રહેશે. તેની કોઈપણ જવાબદારી અત્રેની કચેરીની અથવા સક્ષમ સત્તાધિકારી/કર્મચારી જેને સત્તા સોંપવામાં આવી છે, તેમની રહેશે નહીં.

(૪૫) સદર બાંધકામ પરવાનગી સવાલવાળી જમીન માટે વિકાસ પરવાનગી, સી.ઓ.પી, વૃક્ષારોપણ, વોટર રીચાર્જીંગ, એચ.એફ લેવલ, કોર્ટ મેટરની બાંહેધરી, વિગેરે બાબતે આપેલ બાંહેધરીની વિગતો જમીનમાલિકને બંધનકર્તા રહેશે.

(૪૬) કલેક્ટરશ્રી, ભરૂચના ક્રમાંક:ભુમી/બિ.ખે./વશી/૨૨૦૦ તા.૨૫/૦૪/૨૦૧૭ થી રહેણાંક તથા વાણિજ્યના હેતુ માટે બિનખેતી હુકમ આપેલ છે. તેની તમામ નિર્દીષ્ટ શરતોનું પાલન કરવાનું રહેશે.

મોજે.રહાડપોર, તા.જી.ભરૂચના ભરૂચ-પાલેજ-
ટંકારીયા રોડ વિસ્તારના બ્લોક નં.૩૮, ક્ષેત્રફળ:-
૬૫૭૬.૦૦ ચો.મી. પરત્વે

બ્લોક નં.એ થી પી

હોલો પ્લોન:-૨૯૮૩.૩૬ ચો.મી., હાયર ગ્રાઉન્ડ



GRM CONSTRUCTION

PARTNER

ફલોર:-૨૯૭૩.૩૮ ચો.મી. પ્રથમ માળ:-૨૯૩૯.૩૬
ચો.મી. બીજો માળ:- ૨૯૩૯.૩૬ ચો.મી., ત્રીજો
માળ:-૨૯૩૯.૩૬ ચો.મી., ચોથો માળ:- ૨૫૭૫.૭૮
ચો.મી., ટેરેસ ફલોર:-૩૨૬.૫૬ ચો.મી., કુલ
બિલ્ડઅપ એરીયા:-૧૭૬૭૭.૧૬ ચો.મી.,

બાંધકામ પરવાનગી નં. ૧૧૫૦
નં.બૌડા/બાંધકામપરવાનગી/વશી/૩૪૫
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ ૩૭
સત્તામંડળ, ભરૂચ
તા.૦૨/૦૧/૨૦૧૮



મુખ્ય કારોબારી અધિકારી
ભરૂચ-અંકલેશ્વર શહેરી
વિકાસ સત્તા મંડળ
ભરૂચ

GRM CONSTRUCTION

PARTNER